



## RAJKOT URBAN DEVELOPMENT AUTHORITY



SHRI CHIMANIBHAI PATEL VIKAS BHAVAN, POST BOX NO.238, JAMNAGAR ROAD, RAJKOT.

નં.- રૂડા/ટેક/ડી.બી./ઝોન સર્ટી/દિ.પુ.વિ.ચો./૨૦૩૧/૬૨૩૬

તા. ૨૧-૧૨-૨૦૧૮

પ્રતિ

શ્રી ધનશ્યામ વાલજી કોરાટ વિગેરે

C/O જીઓશેપ કન્સલ્ટન્ટ પ્રા.લી.

૨૦૯/એ-ફોરપ્લસ કોમ્પ્લેક્સ,

સરદારનગર મેઈન રોડ,

એસ્ટ્રોન ચોક,

રાજકોટ.

વિષય :- ઝોનીંગ સર્ટીફિકેટ આપવા અંગે.

સત્તામંડળ (રૂડા)ની દ્વિતીય પુનરાવર્તિત વિકાસ યોજના-૨૦૩૧ અન્વયે.

સંદર્ભ :- આપશ્રીની તા. ૧૯-૧૨-૨૦૧૮ ની અરજી અન્વયે.

ઉપરોક્ત વિષયે આપશ્રીની અરજીમાં નિર્દિષ્ટ વિસ્તાર/સાથે સામેલ નકશા મુજબ મોજે- વેરાવળ તાલુકો- કોટડાસાંગાણી ના રેવન્યુ સર્વે નં.- ૨૫૮ અંતિમ ખંડ નં.- ----- પ્લોટ નં.- ----- ની જમીન, ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ ની કલમ-૧૭(૧)(સી) અન્વયેના સરકારશ્રીના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ, ગાંધીનગરના જાહેરનામા નં.- જીએચ/વી/૧૯૨ ઓફ ૨૦૧૬/ડીવીપી-૧૩૨૦૧૬-૨૨૩૭૦૨-એલ, તા. ૨૭-૧૦-૨૦૧૬ થી મંજૂર રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળની દ્વિતીય પુનરાવર્તિત વિકાસ યોજના-૨૦૩૧ ની અમલી દરખાસ્તો મુજબ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં સુચિત કરાયેલ છે. પુર્વે ૨૪.૦ મીટર પ્રપોઝડ ડી.પી. રસ્તાની કપાત થાય છે.

સદરહુ જમીન મોજે - ----- ની ટી.પી. સ્કીમ નં.- ----- ના હદ વિસ્તારમાં આવતી હોવાથી, તેને ટી.પી. સ્કીમ હેઠળની અન્ય દરખાસ્તો/જોગવાઈઓ લાગુ પડશે અને ફેરફારને પાત્ર રહેશે.

ખાસ નોંધ:-

આ ફક્ત ઝોનીંગ સર્ટીફિકેટ છે. વિકાસ/બાંધકામની પરવાનગી નથી.

A.R. Patel

જુનિયર નગર નિયોજક

રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ

કે.એસ.

રાજકોટ

મુકેશ


## SECOND REVISED DEVELOPMENT PLAN 2031 A.D.

(Sanctioned under sec 17 (1) (c) of the Gujarat Town Planning & Urban Development Act. 1976)

Vide U.D.& U.H. Department Notification No.GH/V/192 of 2016 /DVP-13-2016-223702-L,Dated 27-10-2016.

Sanctioned Variation in the Second Revised Development Plan of RAJKOT URBAN DEVELOPMENT AUTHORITY (RUDA)  
under Government Notification of Urban Development & Urban Housing Department

No.GH/V/276 of 2017 /DVP-132017-725-L,Dated 13-10-2017 & It's Corrigendum No.GH/V/296 of 2017 /DVP-132017-725-L, Dated 24-10-2017



**NOTE :** This Part Plan can not be used for making any entry in revenue records and can not be Considerred as Development Permission for Addition/Alteration.

**SURVEY NO.:** 258

VILLAGE : VERAVAL

**TALUKA : KOTDA SANGANI**

T.P.S. NO. : \_\_\_\_\_

F.P. NO. :

Prepared By :                     

Checked By : Mr. [Signature]

DATE : 20-DEC-2018

 **Industrial Zone**  
 **Water Body**  
 **Proposed Road**  
 **Rail Track**  
 **Village Boundary**



SCALE 1 CM. = 80 MT.

**TRUE COPY**

A.R. Patel

## JUNIOR TOWN PLANNER

**RAJKOT URBAN DEVELOPMENT AUTHORITY  
RAJKOT**